

અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ, વડોદરા

ઘોરણ - ૩

દિવાળી સ્વાધ્યાય : વર્ષ - ૨૦૧૧ -૧૨

વ્હાલા બાળકો,

રજાઓ ! તમારી મનપસંદ વાનગીઓ ખાવાનો સમય.

૧. કોઈ પણ ૩ ભોજનની વાનગી પસંદ કરો અને નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે તમારી ગુજરાતીની નોટમાં લખો.

વાનગી નં. : ૧

૧. વાનગીનું નામ :

૨. જ વ્યક્તિઓ માટે :

૩. ખોરાકનાં ઘટકો :

૪. રીત :

રીત - ૧

અને આ પ્રમાણે આગળ લખો.

૫. લીધેલ સમય :